

સ્ટેચુ ઓફ યુનિટીમાં 600 પ્રવાસીની ક્ષમતા ધરાવતી ફૂઝનું લોન્ચિંગ

250 લોકો માટે ડાઈનિંગ, વિશાળ સ્ટેજ તેમજ આકર્ષક ડેકોરેટિવ લાઈટિંગ જેવી સુવિધાઓ

ફૂઝ પ્રવાસી માટે આકર્ષણાનું કેન્દ્ર બની રહેશે

ગાંધીનગર: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનને વધુ વેગ આપવા માટે નર્મદા નદીમાં 600 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ફૂઝનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. તમામ

જરૂરી સુરક્ષા ધોરણો અને સંબંધિત વિભાગોની પૂર્વ મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં આ ફૂઝ સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. નવી ફૂઝના ઉમેરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વસ્તરીય પ્રવાસન સુવિધાઓમાં વધારો થયો છે.

હાલમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 200 પ્રવાસીની ક્ષમતા ધરાવતી ફૂઝ સંચાલિત થઈ રહી છે, જેને દેશ-વિદેશના પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. નર્મદા નદીમાં ફૂઝ પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી અને આસપાસના કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ મળતો હોવાથી પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને

ધ્યાનમાં રાખીને વધુ વિશાળ અને આધુનિક ફૂઝ લોન્ચ કરવામાં આવી હતી.

નવી ફૂઝને માત્ર પ્રવાસન પૂરતી મર્યાદિત રાખવામાં આવી નથી, પરંતુ તેને વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને કોર્પોરેટ કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. આ ફૂઝ પર સમાદિવસની ઉજવણી, લગ્ન પૂર્વ સમારંભો, કોર્પોરેટ ઇવેન્ટ્સ, પ્રોડક્ટ લોન્ચ, સંગીત સંધ્યા, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ખાનગી ઉજવણીઓનું આયોજન કરી શકાશે.

નવી ફૂઝમાં એકસાથે 600 પ્રવાસીઓની મુસાફરી ક્ષમતા, 250

લોકો માટે ડાઈનિંગ સુવિધા, 30 મીટર લંબાઈ, 12 મીટર પહોળાઈ, 5×4 મીટરનું વિશાળ સ્ટેજ તેમજ આકર્ષક રેકોરેટિવ લાઈટિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખાસ કરીને સાંજ અને રાત્રિના સમયે લાઈટિંગથી ફૂઝનું સૌંદર્ય અનેકગણું વધશે. હાલની ફૂઝમાં 200 પ્રવાસીઓની ક્ષમતા, 100 લોકો માટે ડાઈનિંગ વ્યવસ્થા, 24 મીટર લંબાઈ, 9 મીટર પહોળાઈ અને 4×3 મીટરનું સ્ટેજ ઉપલબ્ધ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ દ્વારા પ્રવાસીઓ માટે આ સુવિધા ઊભી કરવામાં આવી છે.

પાસપોર્ટ વેરિફિકેશનમાં મોટો બદલાવ; હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં

ગાંધીનગર: પાસપોર્ટ મેળવવા માટે પોલીસ વેરિફિકેશન દરમિયાન નાગરિકોને થતી અગવડતા દૂર કરવા ગુજરાત પોલીસ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે તમામ પોલીસ સ્ટેશનોને સૂચના આપી છે કે હવે પાસપોર્ટ વેરિફિકેશન માટે અરજદારોને પોલીસ સ્ટેશન પર રૂબરૂ બોલાવવામાં આવશે નહીં. નવી વ્યવસ્થા હેઠળ માત્ર અરજદારની નાગરિકતા અને ગુનાહિત પૂર્વ ઇતિહાસની ચકાસણી કરવામાં આવશે, જ્યારે સરનામાની અલગથી તપાસ કે અરજદારની રૂબરૂ હાજરી જરૂરી રહેશે નહીં. રાજ્ય પોલીસ વડા દ્વારા તમામ પોલીસ અધિકારીઓને આ નવી પ્રક્રિયાનું કડકપણે પાલન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ પાસપોર્ટ વેરિફિકેશન પ્રક્રિયાને વધુ સરળ, પારદર્શક અને નાગરિકમૈત્રી બનાવવાનો છે, જેથી અરજદારોને બિનજરૂરી ધક્કા ન ખાવા પડે.

ગુજરાતના આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ ડિસીઝના ૩૦,૫૨૧ દર્દી

અમદાવાદ: ગુજરાતનો આદિવાસી વિસ્તાર સિકલ સેલની બીમારીથી ગ્રસ્ત છે. ગુજરાત રાજ્યમાં આદિવાસી વિસ્તારમાં ૩૦,૫૨૧ દર્દીઓ સિકલ સેલ ડિસીઝથી પીડાઈ છે. દેશના આદિવાસી વસતી ધરાવતાં ૧૭ રાજ્યોમાં સિકલ સેલ

ડિસીઝમાં ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં આદિવાસી વસતી ધરાવતા ૧૩ જિલ્લામાં ૧ કરોડથી વધારે આદિવાસી સમાજના લોકો રહે છે. સિકલ સેલ ડિસીઝ દર્દીઓમાં ઓરિસ્સાના ૧૦૬,૨૫૫ અને મધ્યપ્રદેશના ૪૦,૪૮૬ બાદ ગુજરાત

ત્રીજા ક્રમે આવે છે તે ચિંતાનો વિષય છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. પાર્થવિરાજસિંહ કઠવાડિયાએ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સંસદમાં પ્રસ્તુત આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં માત્ર દર્દીઓ જ નહીં સિકલ સેલ કેરિયરનો આંકડો પણ

ચોંકાવનારો છે. દેશના કુલ સિકલ સેલ કેરિયરના ૨૫% કેસો ગુજરાતમાં જોવા મળે છે. દેશમાં આદિવાસી વસતી ધરાવતાં ૧૭ રાજ્યોમાં ૭.૨૬ કરોડ આદિવાસી સમુદાયના લોકોનું સિકલ સેલ ડિસીઝ માટે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.

BUSINESS મિત્ર

શેરબજારમાં નવો નિયમ અને ફૂડનો ડબલ ડોઝ: રોકાણકારોના ૩ લાખ કરોડ ધોવાયા

નવી સિસ્ટમની અનિશ્ચિતતા વચ્ચે સેન્સેક્સ હાઇથી ૯૦૦ પોઇન્ટ ગબડ્યો

ગ્લોબલ રિફવરી છતાં ભારતીય માર્કેટમાં સાર્વત્રિક વેચવાલી; મિડકેપ અને રિયલ્ટી સેક્ટરે ડૂબાડ્યા

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી અમદાવાદ, તા. 4: ભારતીય શેરબજારમાં ગઈકાલથી ક્લોઝિંગ ઓકશન સેશનની નવી સીસ્ટમ શરૂ થતા બજારમાં ઘણી અનિશ્ચિતતા છે. જેથી શેરદલાલોએ રિટેઇલરોને પણ સેલર્ટ કર્યાં છે. તેની અસર સતત બીજા દિવસે જોવા મળી હતી. જેમાં કુડ ઓઈલના ભાવમાં વધારો થવાના કારણે દબાણ વધી ગયું હતું. આ દબાણના કારણે ઈન્ડોએમાં હાઈથી 900 પોઈન્ટથી વધુ લપસી રહ્યો હતો, જ્યારે નિક્ફટી પણ 24450ની નીચે આવી ગયો હતો. જોકે, વ્યાપક સ્તરે સ્મોલકેપ સ્પેસમાં રીકવરી જોવા મળશે. નિક્ફટી મિડકેપ ઈન્વેક્સ રીકવર થયો નહતો અને લગભગ અડધા ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો., પરંતુ નિક્ફટી સ્મોલકેપ ઈન્વેક્સ સહજ ઘટાડાથી રીકવર થયો હતો.

સેક્ટર વાર્ઠજ જોઈએ તો એફએમસીજી, આઈટી અને પ્રાઈવેટ બેન્કીંગ સેક્ટરે દબાણ સર્જ્યું હતું,

ચાર્ન બજાર સુરત (GST સાથેના ભાવ)	નરેશ / મુકેશ દાીવાળા 3૫૧૬૪૬૪ - ૨૫૯૯૯૯૪			
પ્રદુલ/શાહનગર/કેપોલન	ક્રૂ.	બ/પ/ક્રૂ.	''	૧૩૧
૩૦/૧૪ બ્રાઇટ	૨૫૩	૫૦/૩૬	''	૧૪૦
૩૦/૩૬ એફડી	૨૬૨.૫	૫૦/૪૮ SD/કેપ		૧૪૬
લોલવ		RIL રિલાયન્સ		
૬૨/૩૬ ક્રિમ્	૧૪૪	૮૦/૩૬ ક્રિમ્	૧૩૫.૫	૧૪૧
૬૮/૩૬	૧૩૮.૫	૧૧૪-૪૩ ટોલો	---	---
૭૨/૩૬ ક્રિમ્	૧૩૬.૫	૧૦૦ ટેક્ઝ	૧૩૪.૫	૧૪૧
૮૦/૩૬ ક્રિમ્	૧૩૪.૫	વેલોનલ (જીએસટી સાથે)		
૮૪/૪૮ ક્રિમ્	૧૩૫.૫	૮૦/૭૨ ટોલો	૧૪૦	૧૪૦
૩૦/૧૪ ક્રિમ્		૮૦/૭૨ કોલેટર	૧૪૮.૨૫	૧૪૦
૮૦/૭૨ ટોલો.	૧૩૮.૫	૧૬૦ ડીસેટ	૪૮.૨૫	---
૮૦/૩૬ ટોલો.	૧૩૦.૫	૩૦/૨૪ બ્રાઇટ	---	---
૧૫૦/૪૮બ્રાઇટ	૧૩૪	૩૦/૩૬ એફડી	---	---
		૮૦/૧૦૮ ''	૧૪૧.૫	TPM
				૧૩૯

અમેરિકાના અર્થતંત્ર પર સંકટ આધ્યુ ત્યારે તેણે જાપાનના યેનની ખરીદી શરૂ કરી

ભારતનો રૂપિયો તૂટી રહ્યો છે, તેને ઊગારવા અમેરિકા દોડી આવતું નથી; પણ જાપાનના યેનને બચાવવા અમેરિકા દોડી આવ્યું છે, તેની પાછળ તેનો જાપાન માટેનો પ્રેમ જવાબદાર નથી, પણ પોતાનો સ્વાર્થ જવાબદાર છે. ડોલર સામે યેનની નબળાઈએ માત્ર જાપાનના અર્થતંત્રને અસર કરી નથી, પરંતુ વૈશ્વિક નાણાંકીય બજારમાં પણ ચિંતા ઊભી કરી છે. બે દિવસ પહેલાં જાપાનનો યેન ૧૮૮૬ પછીના સૌથી નબળા સ્તરે ગગડી ગયો હતો. ત્યારે ૧ ડોલર બરાબર ૧૬૪ યેનનો ભાવ થઈ ગયો હતો. યેનને પડતો રોકવા માટે અમેરિકાએ એક દાયકાથી વધુ સમય પછી અચાનક જાપાનીઝ યેન ખરીદવાનું શરૂ કર્યું છે. તાવેતરના દિવસોમાં અમેરિકા દ્વારા ૫ થી ૧૦ અબજ ડોલરના યેન ખરીદવામાં આવ્યા છે. અમેરિકાના આ પગલાં પછી તરત ૧ વૈશ્વિક બજારોમાં જાપાનીઝ યેનના મૂલ્યમાં વધારો થયો હતો, જે ત્રણ મહિનાની ટોચે પહોંચ્યો હતો. શુક્રવારે યેન ડોલર સામે ૧૫૪.૪૦ પર બંધ થયો હતો. યેનની અચાનક રિકવરી એ બજારની સામાન્ય ઘટના નથી, પરંતુ અમેરિકા અને જાપાન વચ્ચેની સંયુક્ત વ્યૂહરચનાનું પરિણામ છે. પ્રશ્ન એ થાય છે કે અમેરિકા અચાનક જાપાનના યાવણને બચાવવામાં આટલો બધો રસ કેમ લેવા લાગ્યું છે?

ભલે તમને લાગતું હોય કે અમેરિકા તેના સાથી દેશ તરીકે જાપાનને મદદ કરી રહ્યું છે, પણ આ પાછળ અમેરિકાનો વ્યક્તિગત સ્વાર્થ છે. જાપાન યુએસ ટ્રેઝરી બોન્ડનો વિશ્વનો સૌથી મોટો વિદેશી રોકાણકાર



બજારમાં યેનની માંગ વધી છે અને તેની કિંમત સ્થિર થવા લાગે છે. જો કે, જાપાન દ્વારા મોટા પ્રમાણમાં યુએસ ટ્રેઝરી બોન્ડનું વેચાણ અમેરિકાના બોન્ડ માર્કેટ પર સીધી અસર કરે છે. અમેરિકાની ચિંતાનું કારણ શું છે? અમેરિકા પહેલાંથી ૧૪ વર્ષનાં દેવાં અને તેના વધતા ખર્ચનો સામનો કરી રહ્યું છે. તાવેતરના મહિનાઓમાં ૩૦ વર્ષનો યુએસ ટ્રેઝરી વ્યાજનો દર ૫.૨ ટકાને વટાવી ગયો છે, જે ૨૦૦૭ પછીનો સૌથી ઉચ્ચતમ સ્તર છે. બોન્ડના વ્યાજનો દર વધે તેમ અમેરિકાને તેનાં દેવાં પર વધુ વ્યાજ ચૂકવવું પડે છે. અમેરિકાનું કુલ દેવું આશરે ૪૦ ટ્રિલિયન (૪૦,૦૦૦ અબજ) અમેરિકન ડોલર પર પહોંચી ગયું છે, જેના પર દર વર્ષે આશરે ૧ ટ્રિલિયન ડોલર જેટલું તો વ્યાજ ચૂકવવું પડે છે. આ રકમ અમેરિકાના સરકાર બજેટ કરતાં પણ વધુ છે. જાપાન જેવા દેશે જો પોતાની પાસેના અમેરિકન ટ્રેઝરી બોન્ડ વેચવા કાંટે તો અમેરિકાને વ્યાજના દરો ઘટાડવા પડે છે, જેને કારણે અમેરિકામાં કુગાવો પણ વધી શકે છે. અમેરિકાને આગામી

જાપાનમાં આવેલા પ્રચંડ ભૂકંપ પછી યેનના મૂલ્યમાં તીવ્ર ઘટાડો થયો હતો અને ૮7 દેશોએ તેને નિયંત્રિત કરવા માટે સંયુક્ત પગલાં લીધાં હતાં. અમેરિકા અને જાપાન દ્વારા આ સંયુક્ત કાર્યવાહીને મુખ્ય ઉદ્દેશ જાપાનીઝ યેનના મૂલ્યમાં સતત ઘટાડા અને જાપાન દ્વારા અમેરિકાના ટ્રેઝરી બોન્ડના વેચાણને રોકવાનો છે. કાર્ડ પણ દેશના ચલણમાં સતત ઘટાડો તેના સમગ્ર અર્થતંત્ર માટે ખતરનાક બની શકે છે. જ્યારે જાપાનીઝ યેનના મૂલ્યમાં ઘટાડો થાય છે, ત્યારે જાપાન માટે વિદેશથી ખર્ચિત તેલ, ગેસ, ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓની આયાત કુગાવો વધુ મોંઘેલી બની જાય છે. આનાથી દેશમાં કુગાવો વધે છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોનાં ખિસ્સાં પર પડે છે. જ્યારે અમેરિકા જેવો મુખ્ય આર્થિક બેલાડી જાપાનીઝ યેનની ખરીદીને ટેકો આપે છે, ત્યારે જાપાનમાં આયાત સસ્તી થાય છે અને કુગાવો કાબૂમાં આવે છે. અમેરિકા જાપાનના નહીં પણ પોતાના સ્વાર્થ માટે યેન ખરીદી રહ્યું છે.

જાપાનની દાયકાઓ જૂની સસ્તા ધિરાણની નીતિ હવે ડગમગી રહી છે. બેંક ઓફ જાપાન (BoJ) દ્વારા વ્યાજ દરમાં વધારાથી યેન કેરી ટ્રેડ નબળો પડ્યો છે

જાપાન-કોરિયાના બજારોમાં બેઉતરફી વધઘટ

એમેઝોનનું માર્કેટ કેપ પ્રથમ વખત ૩ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું

નવી દિલ્હી, તા. 4: વૈશ્વિક અનિશ્ચિતતાનો માહોલ રોજબરોજ બદલાતો જોવા મળી રહ્યો છે. એક તબક્કે નવે વચ્ચે સુલેહની વાત આવે છે, તો બીજા તબક્કે બંને દેશો વચ્ચે યીલ્ડમાં થોડો ઘટાડો થયો હતો. તો બીજા તબક્કે બંને દેશો વચ્ચે તણાવ વધવાના અહેવાલથી માહોલ ટકા અને કોરિયાનો કોસ્પી 0.49 ટકા ઘટ્યો હતો. જોકે, હેંગસેંગ 0.49 ટકા ઘટ્યો હતો. અંે ઉલ્લેખનીય છે મળ્યો હતો, જોકે પાછળથી એશિયાના

મોટા ભાગના બજારો રીકવર થઈને પોઝિટિવ બંધ રહ્યા હતા. ઈરાન ડીલની અપેક્ષામાં ગઈકાલે અમેરિકન બજારોમાં સારો ઉછળો જોવા મળ્યો હતો. ડાઉ રેકોર્ડ ઉંચી સપાટીએ બંધ થયો. નાસેક પણ ટેક શેરોની પાછળ 2 ટકા વધ્યો હતો. 10 વર્ષના બોન્ડ યીલ્ડમાં થોડો ઘટાડો થયો હતો. જાપાન અને કોરિયાના બજારોમાં ઘટાડો જોવાયો હતો. નીક્કી 0.66 ટકા અને કોરિયાનો કોસ્પી 0.49 ટકા ઘટ્યો હતો. જોકે, હેંગસેંગ 0.49 ટકા ઘટ્યો હતો. અંે ઉલ્લેખનીય છે કે ડાઉ જોન્સ રેકોર્ડ ઉંચા સ્તરે બંધ

થયા હતા. ટેક શેરોએ આ ઉછળામાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. એમેઝોનનું માર્કેટ કેપ પ્રથમવાર ૩ ટ્રિલિયન ડોલરને પાર કરી ગયું છે. ટ્રેડિંગ સેશન દરમ્યાન એનવીડિયા, મેટા પ્લેટફોર્મ્સ, આલ્ફાબેટ અને માર્શકોસોફ્ટના શેરમાં પણ સારો વધારો નોંધાયો હતો. આજરોજ કુડ ઓઈલના ભાવમાં પીમો સુધારો જોવાયો હતો. પાછલા સત્રમાં ભાવમાં ભારે ઘટાડો થયો હતો. આગામી મહિના માટે બ્રેન્ડ કુડ વાયપેટ 0.7 ટકા વધીને 84.39 ડોલર પ્રતિ બેરલ થયો હતો.

LICમાં સરકાર વેચશે ૬.૫% હિસ્સો

10.85 ટકા ડિસ્કાઉન્ટ એટલે કે રૂ. 382ના ફ્લોર પ્રાઇસથી હિસ્સો વેચાશે

સરકાર ૩૧,૪૧૦ કરોડ એકત્ર કરશે

મુંબઈ, તા. 4: ભારત સરકારે એલઆઈસીમાંથી તેમનો 6.5 ટકાનો હિસ્સો ઓએફએસ દ્વારા વેચાણ માટે રહેશે. એલઆઈસીએ કહ્યું હતું કરશે. જેના માટે ગત સેશનનો બંધ

‘૧૦૦% શુદ્ધ’નો દાવો ડાબરને ભારે પડ્યો

મધ અને તેલ સહિત પ્રોડક્ટના વેચાણ પર પ્રતિબંધ મુક્યો

નવી દિલ્હી, તા. 4: ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ડાબર ઇન્ડિયા લિ. સામે કડક કાર્યવાહી કરી છે. FASSAIએ 100 ટકા કુદરતી ઓર્ગેનિક

ઉત્પાદનના દાવાઓને ગેરમાર્ગે દોરવા બદલ ડાબરના ઘણા ઉત્પાદનો પર પ્રતિબંધ મુક્યો છે. FASSAIએ ડાબર ઇન્ડિયાના અનેક ખાદ્ય ઉત્પાદનોના વેચાણ પર પ્રતિબંધ મુકવાનો આદેશ આપ્યો છે. નિયમનકારે જણાવ્યું છે કે, કંપની તેના ઘણા ઉત્પાદનો પર 100 ટકા કુદરતી, 100 ટકા શુદ્ધ અને

100 ટકા ઓર્ગેનિક જેવા દાવા કરી રહી હતી, જે નિયમો સાથે અસંગત હોવાનું જાણવા મળ્યું હતું. FASSAIએ કંપનીને આવા તમામ ઉત્પાદનોનું વેચાણ તત્કાલિક બંધ કરવાનો અને 15 દિવસની અંદર લેવામાં આવેલી કાર્યવાહીનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.



વર્ષમાં તેના સરકારી દેવાંના લગભગ એક તૃતીયાંશ ભાગને ફરીથી ફાઇનાન્સ કરવાની પણ જરૂર પડશે.

જો આ સમયગાળા દરમિયાન બોન્ડનું વ્યાજ વધે છે તો સરકારે નવાં દેવાં પર પહેલાં કરતાં વધુ વ્યાજ ચૂકવવું પડશે. આનાથી અમેરિકાના આર્થિક વિકાસ પર અસર પડી શકે છે. જો જાપાન યેનને બચાવવા માટે પોતાની પાસેના યુએસ ટ્રેઝરી બોન્ડ વેચે છે, તો અમેરિકાની સમસ્યાઓ વધુ વિકરાળ થઈ શકે છે. આ ૧ કારણ છે કે અમેરિકા ડોલર વડે વધુ યેન ખરીદી રહ્યું છે. યેન જાપાનનું ચલણ છે. તેને વૈશ્વિક નાણાંકીય વ્યવસ્થામાં મુખ્ય ચલણ માનવામાં આવે છે. તેની તીવ્ર વધઘટ એશિયન બજારો, કોમોડિટીના ભાવ અને આંતરરાષ્ટ્રીય

વેપારને અસર કરે છે. જો અમેરિકા અને જાપાન યેનને સ્થિર કરવામાં સફળ થાય તો તે નાણાંકીય બજારોમાં અસ્થિરતા ઘટાડી શકે છે. યુએસ બોન્ડ માર્કેટ પર દબાણ પણ ઓછું કરશે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરશે. જો કે, નિષ્ણાતો એવું પણ માને છે કે ફક્ત ચલણ ખરીદીને લાંબા ગાળે યેનને ટેકો આપવો મુશ્કેલ બની શકે છે, સિવાય કે બેંક ઓફ જાપાન તેના વ્યાજ દરોમાં વધારો કરે, જે હાલમાં ખૂબ ઓછા છે.

૨૦૧૧ પછી અમેરિકા દ્વારા જાપાની ચલણની આ ખરીદી બંને દેશો દ્વારા પ્રથમ સંયુક્ત નાણાંકીય હસ્તક્ષેપ છે, જ્યારે બોન્ડ માર્કેટ પર દબાણ પણ ઓછું કરશે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરશે. જો કે, નિષ્ણાતો એવું પણ માને છે કે ફક્ત ચલણ ખરીદીને લાંબા ગાળે યેનને ટેકો આપવો મુશ્કેલ બની શકે છે, સિવાય કે બેંક ઓફ જાપાન તેના વ્યાજ દરોમાં વધારો કરે, જે હાલમાં ખૂબ ઓછા છે. ૨૦૧૧ પછી અમેરિકા દ્વારા જાપાની ચલણની આ ખરીદી બંને દેશો દ્વારા પ્રથમ સંયુક્ત નાણાંકીય હસ્તક્ષેપ છે, જ્યારે બોન્ડ માર્કેટ પર દબાણ પણ ઓછું કરશે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરશે. જો કે, નિષ્ણાતો એવું પણ માને છે કે ફક્ત ચલણ ખરીદીને લાંબા ગાળે યેનને ટેકો આપવો મુશ્કેલ બની શકે છે, સિવાય કે બેંક ઓફ જાપાન તેના વ્યાજ દરોમાં વધારો કરે, જે હાલમાં ખૂબ ઓછા છે.

૨૦૧૧ પછી અમેરિકા દ્વારા જાપાની ચલણની આ ખરીદી બંને દેશો દ્વારા પ્રથમ સંયુક્ત નાણાંકીય હસ્તક્ષેપ છે, જ્યારે બોન્ડ માર્કેટ પર દબાણ પણ ઓછું કરશે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરશે. જો કે, નિષ્ણાતો એવું પણ માને છે કે ફક્ત ચલણ ખરીદીને લાંબા ગાળે યેનને ટેકો આપવો મુશ્કેલ બની શકે છે, સિવાય કે બેંક ઓફ જાપાન તેના વ્યાજ દરોમાં વધારો કરે, જે હાલમાં ખૂબ ઓછા છે. ૨૦૧૧ પછી અમેરિકા દ્વારા જાપાની ચલણની આ ખરીદી બંને દેશો દ્વારા પ્રથમ સંયુક્ત નાણાંકીય હસ્તક્ષેપ છે, જ્યારે બોન્ડ માર્કેટ પર દબાણ પણ ઓછું કરશે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરશે. જો કે, નિષ્ણાતો એવું પણ માને છે કે ફક્ત ચલણ ખરીદીને લાંબા ગાળે યેનને ટેકો આપવો મુશ્કેલ બની શકે છે, સિવાય કે બેંક ઓફ જાપાન તેના વ્યાજ દરોમાં વધારો કરે, જે હાલમાં ખૂબ ઓછા છે.

- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.